

હાઉસિંગ લાભ બદલાયો છે જો આપ ખાનગી મકાનમાલિક પાસેથી આપનું ઘર ભાડે લો

જો આપ કે આપનું ઘર...

અસરકારક ફેરફાર

આ થવાની તારીખ

...25-35 વર્ષના હો અને અપરિણિત હો અને એકલા રહેતાં હો

આપનો હાઉસિંગ લાભ ઘટાડી શકાય છે, કારણ કે વહેંચેલા ઘરમાં રૂમ ભાડે આપવાના ખર્ચ સુધી જ તેની ચૂકવણી કરી શકાય છે

જાન્યુઆરી 2012થી.
કૃપા કરીને નોંધશો કે રાહતો છે, કૃપા કરીને સલાહ લો.

...પ્રથમ કે નવો દાવો કરો, અથવા જો આપના હાલના દાવાની સમીક્ષા કરવામાં આવે

આપની જાતે ભાડું ચૂકવવામાં આપને ખાધ પડી શકે છે, કારણ કે આપના હાઉસિંગ લાભને આપના વિસ્તાર માટે બજારના ભાડાનાં સૌથી ઓછા ત્રીજા ભાગની અંદર ભાડાના સ્તરોના મહત્તમ સુધી જ ચૂકવી શકાય તેમ છે

એપ્રિલ 2011થી.
વર્તમાન દાવાઓ માટે: આપના દાવાની વરસી બાદ 9 મહિના, સિવાય કે આપના ઘરનું કદ બદલાય.

...વધારે ખર્ચાળ મિલકત ભાડે લો અને વધારે ભાડું ચૂકવો (દા.ત. ખર્ચાળ વિસ્તારમાં ખાનગી મકાનમાલિક પાસેથી ભાડે લો)

આપ પ્રત્યેક મિલકત કદ માટે મહત્તમ સુધી જ હાઉસિંગ લાભ મેળવશો:

- 1 બેડરૂમ માટે £250 અઠવાડિયા દીઠ
- 2 બેડરૂમ માટે £290 અઠવાડિયા દીઠ
- 3 બેડરૂમ માટે £340 અઠવાડિયા દીઠ
- 4 બેડરૂમ અથવા 4 બેડરૂમથી વધુ કોઈપણ મિલકત માટે £400 અઠવાડિયા દીઠ

એપ્રિલ 2011થી.
વર્તમાન દાવાઓ માટે: આપના દાવાની વરસી બાદ 9 મહિના, સિવાય કે આપના ઘરનું કદ બદલાય.

...હાલમાં 5-બેડરૂમની મિલકતમાં રહેતા હો અને સ્થાનિક હાઉસિંગ ભથ્થા દર મેળવતા હો

આપ આપના વિસ્તારમાં 4 બેડરૂમની મિલકત માટે મહત્તમ સુધી જ દાવો કરી શકશો - વધારે ખર્ચાળ વિસ્તારોમાં £400 અઠવાડિયા દીઠ ની કેપ સુધી

એપ્રિલ 2011થી.
વર્તમાન દાવાઓ માટે: આપના દાવાની વરસી બાદ 9 મહિના, સિવાય કે આપના ઘરનું કદ બદલાય.

...હાલમાં આપના હાઉસિંગ લાભની સરપ્લસ રકમ ચૂકવવાપાત્ર ભાડાંની ઉપર રાખો (અઠવાડિયા દીઠ મહત્તમ £15)

આપ આ બિલકુલ મેળવી નહીં શકો, કારણ કે કોઈ સરપ્લસ નહીં હોય

એપ્રિલ 2011થી.
વર્તમાન દાવાઓ માટે: આપની વાર્ષિક સમીક્ષા તારીખનાં રોજ, અથવા તે પહેલાં જો આપના ઘરનું કદ બદલાય તો.

...અપંગ હો અને કેરર રાત્રે રોકાય તે માટે વધારાના રૂમની જરૂર હોય

આ શક્ય બનાવવા માટે વધારાની રૂમ સાથે ક્યાંક રહેવાના ખર્ચને (કદના માપદંડ પ્રમાણે) આવરી લેવા માટે આપ હાઉસિંગ લાભ મેળવી શકશો

એપ્રિલ 2011થી.
નવા કે વર્તમાન દાવાઓ માટે તાત્કાલિક અસર સાથે.

માહિતી અને સલાહ માટે ઉપયોગી સંગ્રહનો:

Shelter
0808 800 4444 or
shelter.org.uk/advice

Citizens Advice Bureaux
08444 111 444
adviceguide.org.uk

Community Legal Advice
0845 345 4 345
communitylegaladvice.org.uk

Money Advice Service
0300 500 5000
moneyadvice.service.org.uk

Shelter